

પ્રતિ,
તંત્રીશ્રી,

“રાજકોટ માટે ‘રંગીલું રાજકોટ’ શબ્દ સાચા અર્થમાં સાર્થક થયો છે”.

- શંકરભાઈ ચૌધરી, અધ્યક્ષ ગુજરાત વિધાનસભા

“દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના કારણે ભારત દેશને G-20નું યજમાન પદ મળેલ છે.”

- મેયરડૉ.પ્રદીપ ડવ



પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર દર્શન રાવલદ્વારા પ્રસ્તુત ‘સુનહરી સાંજ’ મ્યુઝીકલ નાઈટનું કવિ શ્રી

રમેશ પારેખ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મેયર ડૉ. પ્રદીપ ડવની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયરશ્રી ડૉ. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તથા નરેન્દ્રસિંહ ઠાકુર, શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝના હસુભાઈ ગોહેલ, પ્રશાંત કાસ્ટિંગના શંભુભાઈ પરસાણા, સ્વાગત ગ્રુપના ઇગનભાઈ બુસા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર તથા સી.કે. નંદાણી તેમજ મહાનગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત હતા.

કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક શ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવેલ હતું કે, રાજકોટ શહેર માટે ‘રંગીલું રાજકોટ’ એ શબ્દ સાચા અર્થમાં સાર્થક થતો દેખાય છે. નગરજનોને દેશભક્તિના માહોલમાં રંગવા માટે આવો સંગીતસભર કાર્યક્રમ યોજવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓને ખુબ-ખુબ અભિનંદન આપુ છું. ખુબજ ટૂંકા ગાળામાં રાજકોટ શહેરે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. રાજકોટ શહેર ખુબ નજીકના ભવિષ્યમાં ‘ડેવલપ્ડ સીટી’ તરીકે આગળ વધશે. શહેરમાં એઈમ્સ, જુદા જુદા ઓવરબ્રીજ, અન્ડરપાસ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોટ તૈયાર થઈ રહ્યું છે. ‘હેપીનેસ ઇન્ડેક્સ’ની દ્રષ્ટીએ રાજકોટ એક રહેવાલાયક શહેર છે. આપણું રાષ્ટ્ર આર્થિક મહાસત્તા તરીકે ઝડપ ભેર મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન દેશની જનતા માટે ખુબ સુખાકારી આપનારું નીવડશે.

આ પ્રસંગે ઉદબોધન કરતા મેયરશ્રી ડૉ. પ્રદીપભાઈ ડવ એ જણાવેલ કે,

“તન, મન, ધન અર્પિત કર દો, અભિનવ અભિયાન કો,
વંદન કર લો અમર શહીદો કે ખુની બલિદાન કો,

हिम शिखरो से ऊंयी कर दो, हिन्दुस्तानी शान को,
और वक्त पडे तो मस्तक टे दो, भारत के स्वाभिमान को”.

विश्वना ँडपथी विकसी रहेल शहेरो पैकी १७मां कमे रहेल राजकोट शहेर वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी तथा गुजरात राज्यना मुज्यमंत्री लुपेन्द्रभाई पटेलना सहयोगथी विकासनी हरएइण लरी रह्युं छे. राजकोट महानगरपालिका द्वारा छेवाडाना मानवी सुधी प्राथमिक सुविधा मणे ते माटे कटीबद्ध छे तेमज शहेरीजनोनी सुभाकारीना जुदा जुदा विकास कामो हाथ धरवामां आवी रह्या छे. शहेरीजनोने इरवाना नवा स्थण मणे ते माटे पए छेल्ला चार मास पहेला अर्बन इरेस्ट भाते रामवननुं निर्माण करेल छे. आ उपरांत आगामी समयमां अटल सरोवरनुं पए लोकार्पण थता शहेरने ऐक सुंदर इरवा माटेनुं स्थण मणशे.

शहेरना विकासमां मान.मुज्यमंत्रीश्री लुपेन्द्रभाई पटेलना नेतृत्ववाणी सरकारनो भुब ज सहकार मणी रह्यो छे.

रंगीला राजकोटना शहेरीजनो तमाम तहेवारो, कार्यक्रमो धामधूमथी उजवे छे. जे ध्यानमां राभी राजकोट महानगरपालिका द्वारा राष्ट्रीय पर्व, गुजरात राज्यनो स्थापना दिवस, होणी धुणेटी तथा दिवाणीना पर्व वगेरे वभते जुदा जुदा कार्यक्रमो करवामां आवे छे.

शहेरना युवानोने रमत गमतनुं प्लेटफ़ोर्म मणी रहे ते माटे रेसकोर्ष संकुलमां जुदा जुदा स्पोर्टसना मेदानो बनाववामां आवेल छे. आ उपरांत वधु ऐक नवुं अध्यतन छन्दोर स्टेडीयम बनाववानी कामगीरी पए चालु छे.

ट्राफ़िकनी समस्या हणवी थाय ते माटे शहेरमां जुदा जुदा विस्तारमां ओवरब्रिज/अन्डरपासनी कामगीरी हाथ धरेल. जेमां, होस्पिटल चोक, रामापीर चोकडी, नानामवा जंकशन परना ओवरब्रिज थोडा समय पहेला ज मान.प्रधानमंत्री नरेन्द्रभाई मोदीना वरद हस्ते लोकार्पण करायेल.

आ उपरांत कालावड रोड परना के.के.वी.चोक तेमज जडुअ चोक भातेना ओवरब्रिज आगामी दिवसोमां लोकार्पण कराशे.

देशना मान.प्रधानमंत्री नरेन्द्रभाई मोदीनी इरंदेशीना कारणे भारत देशने G-20नुं यजमान पद मणेल छे. जे आपणा सौ माटे अत्यंत गौरवनी बाबत छे.

कार्यक्रमना प्रारंभे मंयस्थ महानुभावो द्वारा दीप प्रागत्य करवामां आव्युं. ज्यारे स्वागत प्रवचन म्युनिसिपल कमिशनर अमित अरोरा द्वारा करवामां

આવેલ. કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ગુજરાત વિધાસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનુ બુકે તથા મોમેન્ટો આપી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા ધારાસભ્યશ્રીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ જ્યારે મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા ડે.ચેરમેન સંજયસિંહ રાણા દ્વારા કરવામાં આવેલ.સાથો સાથ ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડના જન્મદિવસ નિમિત્તે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા બુકે આપી શુભેચ્છા પાઠવામાં આવી હતી. જ્યારે આભાર દર્શન પરેશભાઈ પીપળીયા દ્વારા કરવામાં આવેલ. પ્લેબેક સિંગરશ્રી દર્શન રાવલ દ્વારા છોગાળા તારા, મેં વો ચાંદ, પહેલી મહોબ્બત, તુમિલ્યા સારી કી સારી, કભી તુમે જેવા સુપ્રસિદ્ધ ગીતો દ્વારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને ડોલાવી દીધી હતી.